


PART PLAN SHOWING
F.P. NO.:- 292
T.P.S. NO. & NAME :- 21_AMBAVADI
DISTRICT:- AHMEDABAD




1 c.m. = 40 mt.

LEGEND

- Residential Zone I-R1
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road
- BRTS

Part plan as per Second Revised Development Plan, 2021 Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.) by the Urban Development & Urban Housing Department Govt. of Gujarat vide its Notification No.GH/V/2017 of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.



This part plan is certified for the F.P. NO. :- 292

- NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2018.1011...../7886
Amount Recieved Rs. 1000/-
Receipt No.....733/8.....Dtd.11/10/2018.

TRUE COPY

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

Prep. By:

Chd. By:

H. D' man:

AHMEDABAD MUNICIPAL CORPORATION
PART-PLAN SHOWING LOCATION AS PER T.P. SCHEME ONLY

T.P.S. NO. & NAME:- 21- AMBAWADI (FINAL)

F.P. NO:- 292

COLOUR NOTE:-

(1) BOUNDARY OF ORIGINAL PLOT

(2) BOUNDARY OF FINAL PLOT

(3) ROAD


(4) ROAD WIDENING AS PER R.D.P.

(5) BOUNDARY OF T.P. SCHEME

(6) BOUNDARY OF AMC LIMIT



SCALE: 1 cm. = 25.0 m



Note:- This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે સીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. 21/2018.10.11/11979 તા. 11/10/18 થી
નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. 733.1.9 તા. 11/10/18
રૂા. 1000/- વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

PREPARED BY


CHECKED BY

TRACER

JR. DRAFTSMAN

HEAD DRAFTSMAN

T.P.I.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,
મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.
Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- RZ20181011/7885

અરજી તા.:- ૧૧/૧૦/૨૦૧૮

પરોચ નં.:-૭૩૩/૭, તા.:-૧૦/૧૦/૨૦૧૮.

અરજદારશ્રી રૂપેશભાઈ ચોક્સી,
પાલડી, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GH/V/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. :- ૨૧- આંબાવાડી (ફાઇનલ)

ફાયનલ પ્લોટ નં. :- ૨૯૨

રી.ડી.પી. શીટ નં. :- ૧૦૫+૯૧

ની જમીન રહેણાંક ઝોન-૧ (એક) R1 માં આવે છે.

નોંધ:-

૧. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

તારીખ:- ૧૧/૦૭/૨૦૧૮.

જ. ફાઇટસમેન + હેડ ફાઇટસમેન

ખરી નકલ

11/10/2018

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.